

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનની પહેલવહેલી પર્યાવરણીય ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહમાં જોડાઓ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (14 એપ્રિલ 2022) – અર્થ મન્યના ભાગરૂપે સિટી ઓફ બ્રેમ્પટન અર્થ ડેના સપ્તાહના અંતે તમની પહેલવહેલી પર્યાવરણીય ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહ યોજી રહ્યા છે.

પર્યાવરણીય ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહ શનિવારે એપ્રિલની 23મી તારીખે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી 170, ક્લાર્ક બૂલવર્ડ ખાતે સ્થિત નોર્ટન પ્લેસ પાર્કમાં યોજાશે.

આ નિઃશુલ્ક ઈવેન્ટ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે અને તેમાં સિટી ઓફ બ્રેમ્પટનના ડિપાર્ટમેન્ટ્સ, સ્થાનિક સમૂદાયના જૂથો અને બિન-નફાકારક સંસ્થાઓ એક પર્યાવરણીય વિષયલક્ષી સામુદાયિક મેળાના ભાગરૂપે ભાગ લેશે જેમાં નેચર વોકસ અને ટ્રેઝર હન્ટ્સ અને ક્રિડ્સ ઝોન જેવી પ્રવૃત્તિઓ હશે. ઈવેન્ટને બ્રેમ્પટન એનવાયર્મેન્ટલ એડવાઈઝરી કમિટી અને બ્રેમ્પટન એનવાયર્મેન્ટલ અલાયન્સનું સમર્થન મળેલ છે.

ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહ સવારે 11:30 વાગ્યે થશે જેમાં ઉત્કૃષ્ટ વ્યક્તિઓ, વ્યવસાયો અને સંસ્થાઓને સન્માનિત કરાશે જેમણે પર્યાવરણીય આગેવાની પ્રદર્શિત કરી હોય અને એક સ્વસ્થ ટકાઉ અને સ્થિતિસ્થાપક બ્રેમ્પટનના સર્જન માટેના ગ્રો ગ્રીનના સ્થાપિત તેમજ કુદરતી પર્યાવરણોના સંરક્ષણ, વિકાસ અને સંતુલિત કરવાના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

ગ્રો ગ્રીન એવોર્ડ્સનું પ્રાયોજન ઉદાર હાથે ARGO ડિવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા થયું છે.

પ્રત્યેક ઈવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. વધુ જાણકારી માટે અને રજીસ્ટર થવા અહીં મુલાકાત લો

www.brampton.ca/earthmonth.

એક હરિયાળા શહેર તરીકે બ્રેમ્પટન ટકાઉપણાના પ્રયાસો સંદર્ભે અને પર્યાવરણ પર તેના પ્રભાવને ઘટાડવા સંદર્ભે હરણુક્ષણ ભરી રહ્યા છે. અમારી હરિયાળી પહેલો વિશે વધુ જાણવા અહીં આવો: www.brampton.ca.

લિંક:

- [કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન્સ રિડક્શન પ્લાન](#)
- [સેન્ટર ફોર કમ્યુનિટી એનર્જી ટ્રાન્સફોર્મેશન](#)
- [પાર્કલેન્ડ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી](#)
- [અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન](#)

- [દસ લાખ વૃક્ષો \(One Million Trees\):](#)
- [ઇલેક્ટ્રિક બસ ડેમોન્સ્ટ્રેશન અને ઈન્ટિગ્રેશન ટ્રાયલ](#)

સુવાક્ષ્યો

“બ્રમ્પટન એક હરિયાળુ શહેર છે અને હું ઉત્સુકતાથી અમારા પ્રથમ વખત આયોજાયેલ પર્યાવરણીય ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહની રાહ જોઉં છું. આ મહત્વપૂર્ણ ઈવેન્ટ આપણા ટકાઉ શહેર અને તેને તેવું બનાવવામાં મદદ કરનાર દરેક વ્યક્તિને હાઈલાઈટ કરે છે અને તેમને વધાવે છે. હું દરેક વ્યક્તિને 23 એપ્રિલના રોજ નોર્ટન પ્લેસ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા પ્રોત્સાહિત કરું છું.”

- *પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન*

“આ કાઉન્સિલ આપણા શહેરને હરિયાળુ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બ્રમ્પટનના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ વિશે વધુ જાણવા, સ્થાનિક સંસ્થાઓ સાથે વાતચીત કરવા અને તેમાં સામેલ થવા, બહારની હવાનો આનંદ માણવા અને દરરોજ આપણા પર્યાવરણમાં ફેરફાર કરનારાઓને વધાવી લેવા માટે પર્યાવરણીય ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહમાં જરૂર હાજરી આપશો.”

- *પૉલ વિસેન્ટ, પ્રમુખ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ; રિજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5, સિટી ઓફ બ્રમ્પટન*

“અમારી સહુ પ્રથમ પર્યાવરણીય ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહમાં તમારા પરિવાર અને મિત્રોને સાથે લાવશો. અમે 2050 સુધીમાં બ્રમ્પટનમાં સર્જાતા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 80 ટકા ઘટાડો કરવાની યાત્રા પર છીએ, અને નિવાસીઓ આપણા શહેરને સ્વચ્છ, હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્યના માર્ગ પર ચાલતા રહેવામાં મદદ કરી શકે છે.”

- *ડુગ વિલવાન્સ, સિટી કાઉન્સિલર, વૉર્ડ 2 અને 6, સભ્ય, એનવાયર્નમેન્ટ એડવાયઝરી કમિટી; સભ્ય, CEERP કમ્યુનિટી ટાસ્ક ફોર્સ, સિટી ઓફ બ્રમ્પટન*

“અમે કેવી રીતે ટકાઉપણામાં સુધારા લાવી રહ્યા છીએ અને પર્યાવરણીય ધોરણો વધારી રહ્યા છીએ તેના વિશે રહેવાસીઓને માહિતગાર રાખવા માટે સિટી ઓફ બ્રમ્પટન સમર્પિત છે. પર્યાવરણીય ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહમાં આવો અને એક માહિતગાર, માણવાલાયક અને હરિયાળા શનિવારનો આનંદ ઉઠાવો.”

- *પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca